





9th September, 2019

To,

**BSE Limited**, **Corporate Relationship Department** Phiroze Jeejeebhoy Towers, Dalal Street, Fort Mumbai – 400 001

# Ref No.: Company Code No.-539760

# Sub.: In Compliance with SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015

Dear Sir/Madam,

The 10th Annual General Meeting (AGM) of the Members of RELICAB CABLE MANUFACTURING LIMITED will be held on Monday, September 30, 2019 at 2:00 p.m. at Registered office of the Company at 57/1,(4-b) Benslore Industrial Estate, Dunetha, Daman-396210 (U. T) to transact the business as detailed in the Notice which has been sent to the Members along with the Annual Report and Audited Financial Statement for the year ended the 31<sup>st</sup> March, 2019.

Further pursuant to Section 91 of the Companies Act, 2013 and the Rules framed there under, the Register of Members and Share Transfer Book of the Company will remain closed from Tuesday, 24<sup>th</sup> September, 2019 to Monday, 30<sup>th</sup> September 2019, inclusive of both days.

Advertisement in respect of the same as published on 8th September 2019 is attached herewith

Please take the above on record and oblige.

Thanking you,

Yours faithfully,

# For **RELICAB CABLE MANUFACTURING LIMITED**

SD/-

Khushboo Desai **Company Secretary** ACS : A45510

## Relicab

#### **RELICAB CABLE MANUFACTURING LIMITED**

Registered Office: 57/1,(4-B) Benslore Industrial Estate, Dunetha, Daman - 396210 (U. T) CIN: L27201DD2009PLC004670

# NOTICE OF 10<sup>TH</sup> ANNUAL GENERAL MEETING, BOOK CLOSURE, CUT-OFF \_\_\_\_\_\_\_\_DATE AND E-VOTING INFORMATION

Notice is hereby given that:

1. 10th Annual General Meeting of the Company will be held on Monday, 30th September, 2019 at 2.00 p.m. at the Registered office of the Company (57/ 1.(4-b) Benslore Industrial Estate Dunetha, Daman - 396210 (U. T).

Pursuant to Section 91 of the Companies Act, 2013 read with Rule 10 of the Companies (Management and Administration) Rules, 2014, the Register of Members and Share Transfer Books will be closed from Tuesday, 24th September, 2019 to Monday, 30th September, 2019 both days inclusive for the purpose of taking record of the Company's shareholders.

- Information pursuant to Section 108 of the Companies Act, 2013 read with the 2. Companies (Management and Administration) Rules, 2014 and Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015:
  - a. The dispatch of Notice of AGM was completed on 07th September, 2019.
  - b. All the business set out in the said notice may be transacted by electronic voting.
  - The date and time of commencement of remote e-voting is Friday, September c. 27, 2019 at 9:00 am
  - The date and time of end of remote e-voting is Sunday, September 29, d. 2019 at 5:00 pm.
  - The cut-off date for determining the eligibility to vote by electronic means or in the annual general meeting is Monday, September 23, 2019. e.

Those person who have acquired shares and become members of the f. Company after the dispatch of notice shall exercise their voting rights through remote e-voting by the procedure mentioned in the Notice of the AGM under "Voting through electronic means" (available on the website of the Company at www.relicab.net), or by voting at the AGM.

- g. The statement
  - Remote e-voting shall not be allowed beyond Sunday, September 29, (A) 2019 at 5:00 p.m.
  - (B) The facility for voting through ballot will also be made available at the AGM only for members who have not casted their vote by remote e-voting.
  - (C) A member may participate in the general meeting even after exercising his right to vote through remote e-voting but shall not be allowed to vote again in the meeting
  - (D) A person whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date i.e. 23rd September, 2019 shall only be entitled to avail the facility of remote e-voting as well as voting in the general meeting. The Notice of the meeting is displayed on the Company's website
- h. www.relicab.net and on the website of the agency - www.evoting.nsdl.com

i. Contact details for the grievances connected with the electronic voting: Sharex Dynamic India Private Limited

Email : sharexindia@vsnl.com

Phone No. : 022 - 28515606/28515644

By Order of the Board For RELICAB CABLE MANUFACTURING LIMITED Sd/-Khushboo Desai Place: Mumbai Date: 08th September, 2019 **Company Secretary & Compliance Officer** 





9<sup>th</sup> September, 2019

BSE Limited, Corporate Relationship Department Phiroze Jeejeebhoy Towers, Dalal Street, Fort Mumbai - 400 001

Ref No.: Company Code No.-539760

#### Sub.: In Compliance with SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015

Dear Sir/Madam,

Τo,

The 10th Annual General Meeting (AGM) of the Members of RELICAB CABLE MANUFACTURING LIMITED will be held on Monday, September 30, 2019 at 2:00 p.m. at Registered office of the Company at 57/1,(4-b) Benslore Industrial Estate, Dunetha, Daman-396210 (U. T) to transact the business as detailed in the Notice which has been sent to the Members along with the Annual Report and Audited Financial Statement for the year ended the 31<sup>st</sup> March, 2019.

Further pursuant to Section 91 of the Companies Act, 2013 and the Rules framed there under, the Register of Members and Share Transfer Book of the Company will remain closed from Tuesday, 24<sup>th</sup> September, 2019 to Monday, 30<sup>th</sup> September 2019, inclusive of both days.

Advertisement in respect of the same as published on 8th September 2019 is attached herewith

Please take the above on record and oblige.

Thanking you,

Yours faithfully,

## For **RELICAB CABLE MANUFACTURING LIMITED**

Khushboo Desai **Company Secretary** ACS : A45510

VADODARA EDITION

FREE PRESS GUJARAT Sunday, Septemder 8, 2019

# NHSRCL provides skills training to youth of Anand, Kheda

Limited (NHSRCL) which is project affected families to make them self-employed.

Recently, NHSRČL in association with the Rural Development and Self Training Employment (RUDSET) Institute completed a 45 days skill development training programme for the youth of Anand and Kheda

programme is meant to activities for the project affected individuals or families.

networking programme for prospective youth was started by Nadiad-based RUDSET on June 26.

Twenty six youth from six villages of Kheda and five villages of Anand benefitted from the skill development training programme.

The youth who underwent training received certificates development programme is for future entrepreneur training programme during a generate activities for the ceremony at Nadiad which witnessed presence of Kheda district collector Sudhir Patel, NHSRCL's managing director Achal Khare, Kheda's district superintendent of police Divya Mishra, NHSRCL, Vadodara's chief project The youth who underwent manager Pradeep Ahirkar, training received certificates RUDSET's director Arvind for future entrepreneur

High Speed Rail Corporation project affected persons and their families. "This relationship implementing the bullet train is not of just give and take but project between Ahmedabad of growing together. NHSRCL and Mumbai has started will follow up with all training efforts to train youth from participants in future and will try to help in whatever way we can in the years to come," said Khare.He also announced that if the youth are ready to join hands to make a co-operative like Amul, NHSRCL will provide all its assistance to such an initiative.Similar training programmes including those on

mobile repairing, beauty parlour, bike repairing among others The skill development have been planned in various. The National High restore income and generate Speed Rail Corporation Limited (NHSRCL) which is implementing the bullet train project between Ahmedabad Under the programme, a and Mumbai has started computer hardware and efforts to train youth from project affected families to make them self-employed.

Recently, NHSRCL in association with the Rural Development and Self Employment Training Institute (RUDSET) completed a 45 days skill development training programme for the youth of

Anand and Kheda. The skill meant to restore income and project affected individuals or families.Under the programme, a computer hardware and networking programme for prospective youth was started by Nadiadbased RUDSET on June 26.

# **AROMA ENTERPRISES (INDIA) LIMITED**

Reg. Off. : 88, Ajanta Commercial Center Nr. Income Tax Circle, Ashram Road, Ahdbd - 380009 E - Mail : compliance.mgc@gmail.com; Website : www.aromaenterprises.in; Tel.:+ 91 79 27540175 CIN : L51909GJ1994PLC021482

## Notice of 25thAnnual General Meeting, E - Voting and **Book- Closure**

Notice is hereby given that:

- 1. The 25th Annual General Meeting (AGM) of the Company will be held on Monday, 30th September, 2019 at 11a.m. at the Registered Office at 88, Ajanta Commercial Center Nr. Income Tax Circle, Ashram Road Ahmedabad - 380009 to transact the Business as set out in the Notice of AGM
- Physical copies of the Notice of AGM have been sent to all 2. the members at their registered address in the permitted mode

VADODARA: The National Mothaliya and more than 400 training programme during a project affected persons and ceremony at Nadiad which their families. "This relationship district collector Sudhir Patel, NHSRCL's managing director Divya Mishra, NHSRCL, manager Pradeep Ahirkar, RUDSET's director Arvind

witnessed presence of Kheda is not of just give and take but of growing together. NHSRCL will follow up with all training Achal Khare, Kheda's district participants in future and will try superintendent of police to help in whatever way we can in the years to come," said Vadodara's chief project Khare.He also announced that if the youth are ready to join hands to make a co-operative Mothaliya and more than 400 like Amul.

# Relicat

**RELICAB CABLE MANUFACTURING LIMITED** Registered Office: 57/1,(4-B) Benslore Industrial Estate, Dunetha, Daman - 396210 (U. T) CIN: L27201DD2009PLC004670

NOTICE OF 10TH ANNUAL GENERAL MEETING, BOOK CLOSURE, CUT-OFF DATE AND E-VOTING INFORMATION

#### Notice is hereby given that:

 10<sup>th</sup> Annual General Meeting of the Company will be held on Monday 30th September, 2019 at 2.00 p.m. at the Registered office of the Company (57) 1,(4-b) Benslore Industrial Estate Dunetha, Daman - 396210 (U. T)

Pursuant to Section 91 of the Companies Act, 2013 read with Rule 10 of the Companies (Management and Administration) Rules, 2014, the Register of Members and Share Transfer Books will be closed from Tuesday, 24<sup>th</sup> September, 2019 to Monday, 30<sup>th</sup> September, 2019 both days inclusive for the purpose of taking record of the Company's shareholders.

- Information pursuant to Section 108 of the Companies Act, 2013 read with the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015
- The dispatch of Notice of AGM was completed on 07th September, 2019. All the business set out in the said notice may be transacted by electronic b.
- voting. The date and time of commencement of remote e-voting is Friday, Septembe C.
- 27, 2019 at 9:00 am The date and time of end of remote e-voting is Sunday, September 29
- 2019 at 5:00 pm
- The cut-off date for determining the eligibility to vote by electronic means or in the annual general meeting is Monday, September 23, 2019.
- Those person who have acquired shares and become members of the Company after the dispatch of notice shall exercise their voting rights through remote e-voting by the procedure mentioned in the Notice of the AGM under "Voting through electronic means" (available on the website of the Compan at www.relicab.net), or by voting at the AGM.
  - The statement:
- (A) Remote e-voting shall not be allowed beyond Sunday, September 29 2019 at 5:00 p.m.
- (B) The facility for voting through ballot will also be made available at the AGM only for members who have not casted their vote by remote e-voting.
- (C) A member may participate in the general meeting even after exercising his right to vote through remote e-voting but shall not be allowed to vote again in the meeting
- (D) A person whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date i.e. 23rd September, 2019 shall only be entitled to avail the facility of remote e-voting as well as voting in the general meeting.
- The Notice of the meeting is displayed on the Company's website www.relicab.net and on the website of the agency - www.evoting.nsdl.com
- Contact details for the grievances connected with the electronic voting: Sharex Dynamic India Private Limited Email : sharexindia@vsnl.com

Phone No. : 022 - 28515606/28515644

For RELICAB CABLE MANUFACTURING LIMITED Sd/-Place: Mumbai Khushboo Desai Date: 08th September 2019 **Company Secretary & Compliance Officer** 

By Order of the Board

**GUJCHEM DISTILLERS INDIA LIMITED** (CIN: L24230GJ1939PLC002480) REGD. OFFICE: Office No. 6, 2ndFloor, National Chambers, Nr. City Gold, Ashram Road, Ahmedabad - 380 009

# E-mail id: gujchemdistillers@gmail.com Web: www.gujchemdistillers.com


# 50 cattle owners cheated by gang offering to buy their animals

Vadodara: At least 50 cattle owners in Padra have been duped by a gang offering to buy their bovines.

The gang led by Salim Vohra alias Shailesh used to buy cows and buffaloes from the farmers and pay down payment in cash and the remaining amount through post-dated cheques. The cheques however would not be honoured due to want of balance in the accused's bank account. Besides Vohra, other gang members Imtiyaz Ali Malek, Siddique Rana, Gulab

Nabi Vohra, Riyaz Vohra and Rizwan Khan Pathan were arrested on Wednesday. One of the victims Hasmukh Parmar, who be-

came complainant in the case, told police that Salim identified himself as Shailesh and approached him in February with offer to buy 13 cows at the rate of Rs 41,000




providing E-Voting Facility under Section 108 of the Act and the Rules framed there under, as amended from time and under, therefore voting shall first be carried out at the Annual General Meeting through Show of Hands as per Section 107 of Companies Act, 2013 and in case poll has been demanded, in terms of Section 109 of the Companies Act, 2013.

3. The Register of Members and Share Transfer Books of the Company will be closed from Saturday, September 21, 2019 to Monday, September 30, 2019 (both days inclusive) for the purpose of Annual General Meeting and same will be re-opened from Tuesday, October 01, 2019 onwards. Members whose names are recorded in the Register of Members or in the Regster of Beneficial Owners maintained by the Depositories as or the Cut-off date i.e. Friday, September 20, 2019, will be entitled to vote at the AGM. 4. Electronic copies of the Notice of the Annual General Meeting and Annual Report were sent to all the members whose email IDs are registered with the Company / Depository Participant(s). Physical copies of the same were sent to all other members at their registered address in the permitted mode.




learnt that Salim alias for each cow. A week later, Shailesh and his gang had Salim alias Shailesh came to Parmar's cattle shed with a cheated many other cattle owners using similar modus truck to take the cows. He paid Rs 70,000 cash and the remaining amount through cheque. When Parmar deposited the cheque with his bank, it was not returned.

Police said that Parmar then contacted Salim alias Shailesh to pay him his money in cash, but he kept dilly dallying. Few weeks later when Parmar went to the accused's house at Borsad, he was not there, but Parmar



cattle shed with a truck to take the cows. He paid Rs 70,000 cash and the regang's activities, he informed maining amount through cheque. When Parmar deother cattle owners and the posited the cheque with his LCB sleuths. The cattle owners reached Bhatt's cow shed bank, it was not returned.



- the notice of 19th Annual General Meeting. he Register of Members and Share Transfer Books of the Company wil remain closed from Saturday, September 21, 2019 to Monday September 30, 2019 (both days inclusive) for the purpose of 19th Annual General Meeting of the Company.
- ectronic copies of the Notice of the 19th (Nineteenth) Annual Genera Meeting and the Annual Report of the Company for the financial year 2018-19 were sent to all the members whose email IDs are registered with the Company / Depository Participant(s). Physical copies of the same were sent to all other members at their registered address in the permitted mode.
- embers of the Company is requested to take note that in pursuance of the provisions of Section 108 of the Act and the Rules framed there under, as amended from time to time, the Company is exempted from giving the Members the facility to cast their vote electronically, through the remote e-voting services on the resolutions set forth in Notice of 19th (Nineteenth) Annual General Meeting. However, voting through permitted mode under the Companies Act, 2013 will be allowed at the venue of Annual General Meeting.
- he Notice of the 19th Annual General Meeting as well as Annual Report for the financial year 2018-19 is also Available on the Company's website www.sikkoindia.com
- n case you have any queries regarding Annual General Meeting, you may write an email to compliance@sikkoindia.com. For, Sikko Industries Limited
  - --sd-Jayantibhai kumbhani na director

3

and nabbed all six accused

and handed over to Padra

A police official said that

they are interrogating the

accused about what they

used to do with the bovines.

"We have learnt that the

gang had cheated at least

50 cattle owners and we

will be taking statements

and complaints of all the

victims," said the police of-

ficial. One of the victims

Hasmukh Parmar, who be-

police station

- 3. Members holding shares either in physical form or in dematerialized form as on the cut - off date on Wednesday, 25th September, 2019, may cast their vote electronically on Business as set out in the Notice of AGM through electronic voting system of Central Depository Service (India) Limited (CDSL). All members are informed that:
- The Business as set out in the Notice of AGM may be a. transacted by electronic voting.
- The voting through electronic means shall commence from b. Thursday, 26th September, 2019 10:00 a.m. and shall end on Sunday, 29th September, 2019 at 05:00 p.m.
- The e voting shall not be allowed beyond 05:00 p.m. of с. Sunday, 29th September, 2019.
- d. Person whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date i.e Wednesday 25th September, 2019 shall be entitled to avail the facility of remote e-voting as well as voting in the general meeting;
- The Notice of AGM is on CDSL's website or www.evotingindia.com
- For the process and manner of electronic voting, members may go through the instructions in the Notice of AGM or visit CDSL's website www.evotingindia.com
- Any person becoming the member of the Company after the dispatch of Notice of the Meeting and holding shares as on the cut - off date i.e. Wednesday 25thSeptember. 2019, may obtain the user ID and password by referring to the e - voting instructions in the notice which is available on CDSL's website on www.evotingindia.com
- Members who have cast their vote by remote e-voting prior to the meeting may also attend the meeting but shall not be entitled to cast their vote again.
- In case of queries, members may refer to the Frequently 6. Asked Questions (FAQ's) for members and e-voting user manual for members under the HELP section of www.evotingindia.com or contact to Mr. Abdulqadir Shoeb Hajiwala, Company Secretary and Compliance officer of the Company at the above mentioned address, contact No. 91 79 27540175, mail id : compliance.mgc@gmail.com
- Pursuant to Section 91 of the Companies Act, 2013 read with Rule 10 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 42 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Rules, 2015, the Registrar of Members and Share Transfer Book of company will remain closed from 26th September, 2019 to 30th September, 2019 (Both Days Inclusive) for the purpose of Annual General Meeting of the company to be held on Monday, 30th September, 2019 for the financial year ended on 31st March, 2019.

For, Aroma Enterprises (India) Limited SD/ Mr. Snehal Patel **Managing Director** Date : 07.09.2019 DIN: 03097321 Place: Ahmedabad

> Printed & Published by Mayur C. Bhatt on behalf of Kalyani Pub. Pvt. Ltd Printed at : Mahadev Offset, H-47, Ravi Estate Rustam Mill Compound Dudheswar, Ahmedabad-19. Published From: 37/ A, Rajlaxmi Tanament, Opp. Rami Vidhyalaya, Laxmipura, Gorva, Vadodara-

#### NOTICE OF 80th ANNUAL GENERAL MEETING E-VOTING INFORMATION

NOTICE is hereby given that the 80TH ANNUAL GENERAL MEETING of the Members of the Company will be held on Monday, 30th September 2019 at 4.00 P.M. at the Registered Office of the Company situated at Office No.6, 2nd Floor, National Chambers, Nr. City Gold, Ashram Road, Ahmedabad-380009

The notice of the AGM along with the Annual Report, inter alia, including the remote e-voting instructions, Attendance Slip and Proxy Form has been sent by permitted mode to all members at their registered addresses. Notice of the AGM and this public notice for F Y 2018-19 can be downloaded from the website of the Company www.gujchemdistillers.com and of Central Depository Services (India) Limited (CDSL): www.cdslindia.com Remote e-voting:

Pursuant to the provisions of section 108 of the Companies Act, 2013, read with Rule 20 of the Companies (Management and Administration) Amendment Rules, 2015 ("the Rules"), and Regulation 44 of SEBI (Listing Obligations and Disclosure Requirements), Regulations, 2015 the Company is providing its members, the facility to exercise their right to vote by electronic means on all the business to be transacted as set forth in the Notice of the AGM of the Company through the remote e-voting facility provided by CDSL. The detailed instructions for remote e-voting facility are contained in Notice of the AGM which has been sent to the Members. The details pursuant to the provisions of the Companies Act, 2013 and the Rules are given hereunder:

Cut-off date for the purpose of remote e-voting: 23.09.2019

Date and time of commencement of remote e-voting: On 27th September, 2019 from 10:00 A.M.

Date and time of end of remote e-voting: On Sunday 29th September, 2019 at 5:00 P.M.

Remote e-voting shall not be allowed beyond the said time and date. Persons who have acquired shares and become members of the Company after dispatch of the Notice of the AGM and holding shares as on the cut-off date i.e 23th September, 2019 may cast their votes by following the instructions and process of remote e-voting as provided in the Notice of the AGM.

A person whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date only shall be entitled to avail the facility of remote evoting as well as voting in the AGM. However if the person is already registered with CDSL for remote e-voting than the existing user ID and password can be used for casting their vote.

The members who have already cast their vote by remote evoting prior to the meeting, May also attend the meeting, but shall not be entitled to cast their vote again.

The facility for voting through Poll Paper would be made available at the AGM and the members attending the meeting who have not already cast their votes by remote e-voting shall be able to exercise their right at the meeting through Poll Paper.

In case of any queries relating to e-voting, members/beneficial owners may refer the Frequently Asked Questions and e-voting user manual available at the CDSL website: www.evotingindia.com or contact at toll free number 1800-200-5533. In case of any grievances relating to e-voting please contact Mr. Wenceslaus Furtado, Deputy Manager, CDSL, 17th Floor, PJ Towers, Dalal Street, Fort, Mumbai- 400 001; Email: wenceslausf@cdslindia.com Tel. No. 022-22723333/8588

The entry at the meeting venue will be regulated by Attendance Slip, which has been sent along with the Annual Report to the members. Members are requested to submit duly filled in Attendance Slip at the registration counter to attend the AGM.

Date: 05/09/2019	By Order of the Board of Directors
Place: Ahmedabad	GUJCHEM DISTILLERS INDIA LIMITED
Regd. Office: Office No.6,	Sd/-
2nd Floor, National Chambers, I	Nr. HEM MANISH
City Gold, Ashram Roa	d, MANAGING DIRECTOR
Ahmedabad-380009	DIN-01428688

5. The Notice of AGM and Annual Report is also available on the Company's website www.zodiacenergy.com.

6. Any Query or grievance connected with the AGM may be addressed to the Company Secretary of the Company at Email cs@zodiacenergy.com.

By order of the Board For, Zodiac Energy Limited

	sa
Place : Ahmedabad	Niyati Parikh
Date : September 6, 2019	Company Secretary

# **KOME-ON COMMUNICATION LIMITED**

(CIN:L74110GJ1994PLC021216)

Regd. Off: Block No. 338/Paiky 6/2, Dhamdachi Village, Valsad, Gujarat - 396001 Phone No.: 9820430218 Website: www.komeon.in Email: info@komeon.in

#### Notice

NOTICE IS HEREBY GIVEN that the 26th Annual General Meeting (AGM) of Kome-or Communication Limited will be held on Monday, September 30th, 2019, at 11:00 a.m. at Block No. 338/Paiky 6/2, Dhamdachi Village, Valsad, Gujarat - 396001 to transact the business mentioned in the Notice of AGM sent along with Director's Report, Auditor's Report and the Audited Financial Statements of the Company for the Financial Year ended March 31, 2019.

Notice of AGM and Annual Report for 2018-19, inter alia, including the remote e-voting instructions, Attendance Slip and Proxy Form have been emailed to the members whose email addresses have been registered with the Company / Depository Participant(s) and physical copies of the same have been sent by permitted mode to all other Members at their registered address by September 07th, 2019. The Annual Report is available on the Company's website: www.komeon.in

NOTICE IS FURTHER GIVEN that pursuant to Section 108 of the Companies Act, 2013 Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 44 (1) of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company is providing electronic voting facility from a place other than the venue of AGM ("remote e-voting") provided by NSDL, on all the esolutions set forth in the Notice

The details of remote e-voting are given below:

Place: Valsad

Date: : 07th September, 2019

- (i) The remote e-voting will commence on Friday, September 27, 2019 (09:00 am and end on Sunday, September 29, 2019 (05:00 pm). The e-voting module shall be disabled for voting thereafte
- (ii) The voting rights of Members shall be in proportion to their share of the paid-up share capital of the Company as of the cut-off date i.e. Friday, September 20, 2019. Once a vote is cast by the Member, he shall not be allowed to change it subsequently.
- iii) Any person who acquires equity shares of the Company and becomes a Membe after 30th August, 2019 i.e. cut-off date for dispatch of the Notice and holding shares as of the cut-off date i.e. Friday, September 20, 2019, may obtain the login details by writing to the Company at info@komeon.in or to NSDL at evoting@nsdl.co.in o service@satellitecorporate.com
- v) The Company is also offering the facility for voting by way of physical ballot at the AGM. The Members attending the Meeting should note that those members who are entitled to vote but have not exercised their right to vote by remote e-voting, may vote at the AGM through ballot for all businesses specified in the accompanying Notice The Members who cast their vote by remote e-voting may also attend the AGM but shall not be entitled to cast their vote again.
- (v) A member can opt for only one mode of voting i.e. either through remote e-voting or by e-voting shall prevail and Ballot Form shall be treated as invalid.

In case of any queries pertaining to e-voting, members may refer to the Frequently Asked Questions (FAQs) and e-voting User's Manual available under help section at https:// www.evoting.nsdl.com or email at evoting@nsdl.co.in : Tel. 1800 222 990 (Toll Free No.) For Kome-on Communication Limited

Sd/-
Gajendra Kalulal Salvi
Managing Director

Place: Ahmedabad	Managing director
Date: September 07, 2019	DIN: 00587807

LYPSA GEMS & JEWELLERY LIMITED Regd. Off.: Wing A, 2nd Block, 202-302, Orchid Complex, Opp. HDFC Bank, Chhapi-Pirojpura Road, Chhapi, Vadgam Banas Kantha, 385210, Gujarat, Contact No: 022-23679792. Email ID: info@lypsa.in CIN: L28990GJ1995PLC028270, Website: www.lypsa.in NOTICE

NOTICE is hereby given that the 24th Annual General Meeting of the Members of Lypsa Gems & Jewellery Ltd will be held at Wing A, 2nd Block, 202-302, Orchid Complex, Opp. HDFC Bank, Chhapi-Pirojpura Road, Chhapi, Vadgam Banas Kantha GJ 385210 Gujarat on Monday, 30<sup>th</sup> September, 2019 at 02.00 p.m. to transact the business as set out in the Notice of AGM dated September 5, 2019.

The said Notice along with Proxy form, Attendance Slip and Annual Report inter-alia containing Directors' Report and Audited Financial Statements has been dispatched to all the Members at their registered addresses or email-IDs on or before September 5, 2019 and the same is available on the website of the company at <u>www.lypsa.in</u> The Notice of AGM along with e-Voting instructions is also available on the website of Central Depositon Services Limited (CDSL) at www.evotingindia.com

A member entitled to attend and vote at the meeting is entitled to appoint a proxy to attend and vote instead of himself/herself and the proxy need not be a membe of the Company. Proxies in order to be effective, should be deposited at the Registere Office of the Company, duly completed and signed, not less than 48 hours before the commencement of the AGM

n compliance with the provisions of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended from Time to time, Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and Secretarial standard on General Meetings issued by The Institute of Company Secretaries of India:

- a) The Company is providing remote e-Voting facility to its Members to cast their vote by electronic means on the Resolutions set out in the Notice of the AGM dated September 5.2019
- b) Day, Date and Time of commencement of remote e-Voting: Friday, September 27, 2019 (09.00 a.m.)
- c) Day, Date and Time of end of remote e-Voting; Sunday, September 29, 2019 (05.00 p.m.)
- d) Cut-off date: September 23, 2019
- e) Any person who acquires shares of the Company and becomes a member of the Company after the dispatch of AGM Notice and holds shares as on the cut-off date i.e. September 23, 2019, may obtain Login ID and password by sending request at www.evotingindia.com
- The members who will be attending the AGM and who have not cast their vote throug remote e-Voting shall be able to exercise their voting rights at the AGM. The facility for voting through Tablet based e-Voting system and / or through polling paper shall be made available at the venue of the AGM.
- g) The Members are requested to note that:
  - Remote e-Voting modules shall be disabled by CDSL for voting after 05.00 p.m. on September 29, 2019.
- The members who have already cast their vote through remote e-Voting may attend the meeting but shall not be entitled to cast their vote again at the AGM.
- Members holding shares in physical or in dematerialized form as on September 5, 2019 shall only be entitled to avail the facility of remote e-Voting or voting through Tablet based e-Voting system and/or through polling paper at the

in case you have any queries or issues regarding e-voting, you may refer the Frequently Asked Questions ("FAQs") and e-voting manual available at www.evotingindia.com, unde help section or write an email to helpdesk.evoting@cdslindia.com.

Mrs. Shubham Agarwal, Practicing Company Secretary (CP No. 10640 and FCS 8192) has been appointed as the Scrutinizer for overseeing / conducting the remote e-Voting and the voting process in a fair and transparent manner.

Pursuant to Section 91 of the Companies Act, 2013, the Begister of Members and Shan ansfer Books of the Company will remain closed from Wednesday, September 25, 2019 to Monday, September 30, 2019 (both days inclusive) for the purpose of Annual Genera Meeting to be held on September 30, 2019.

The result of the e-Voting / voting at AGM through Tablet based e-Voting system and / or through polling paper shall be declared on or before October 3, 2019 The results declared along with the Scrutinizer's Report shall be placed on the Company's website and nmunicated to stock exchanges where the Company's shares are listed

	For & on behalf of the Board of Director
	Lypsa Gems And Jewellery Limited
	Sd/-
	Company Secretary
Date:5th September, 2019	Akanksha Mundra
Place: Banaskantha	DIN: 02579405

લોકમિત્ર, LOKMITRA ૮ સપ્ટેમ્બર ૨૦૧૯, રવિવાર

# રેડબુલની R1V1R RUNES ઇસ્પોર્ટ્સ ભારત પાછી ફરી રહી છે



૨૦૧૮માં સફળતાપૂર્વક પ્રારંભ કર્યા બાદ આંતરરાષ્ટ્રીય ઇસ્પોર્ટ્સ ઇવન્ટ રેડ બુલ R1v1rRunes ભારત પરત ફરવા માટે સજ્જ છે. R1v1rRunes વિશ્વની સૌથી લોકપ્રિય ઇસ્પોર્ટ્સ રમત ડોટા-૨ને વધુ તીવ્રતા અને વ્યૂહાત્મક ટીમ આધારિત રમતને સમાવેશ થાય છે. બદલાવીને વધુ રોમાંચક બનાવે છે. ટૂંકા ગાળાની, વધુ એકશનથી સજ્જ મેચ એવી રેડ બુલ ઇ૧૬૧ઇિંહીજ સાહીલ 'MiCrO' વિરાડીયા રેડબુલની ઇ૧૬૧ઇિંહીજની નેશનલ ખેલાડી તરીકે ઊભરી આવ્યો હતો.

ક્વોલિફાયર્સના વિસ્તરિત શિડ્યુલમાં સ્પર્ધા કરવાની તક છે. ૩જી સપ્ટેમ્બરથી શરૂ થતા આ શિડ્યૂલમાં ખેલાડીઓ ઓનલાઇન ક્વોલિફાયર્સ તેમજ ોફલાઇન ક્વોલિફાર્યીંગ પ્રેક્ષકગણ સુધી લઇ જશે. (૨૨-૧)

ઇવન્ટમાં ભાગ લઇ શકે છે જે ભારતભરમાં ૨૦ શહેરોમાં સ્થાન લેશે જેમાં મુંબઇ, પૂશે, બેંગાલુરુ, હૈદરાબાદ, જયપુર, દહેરાદૂન, નાસિક, અમદાવાદા, ઇન્દોર, ચેન્નઇ, ગોવા, પોન્ડીચેરી, મેંગલોર, સિલ્યાર, ભવનેશ્વર. કોલકાતા, ગુવાહાટી, રોમાંચક એક વિ એક સ્પર્ધા સાથે જલંધર, લખનૌ અને દિલ્હીનો

રેડ બુલ R1v1r Runesની નેશનલ ફાઇનલમાં વિજેતા થનારને ધી ઇન્ટરનેશનલ ૨૦૧૮ની વિજેતા સ્પર્ધા માટે યોગ્ય સામગ્રી લાવે છે જે ટીમ "બ્ના એક સભ્યને મળવાની તક ખેલાડીઓ અને દર્શકોને મનોરંજન મળશે, જેવિશ્વની સૌથી મોટી, અત્યંત પરું પાડે છે. પાછલા વર્ષે મંબઇના આકર્ષક અને અત્યંત તીવ્રતાથી રમવામાં આવતી ઇસ્પોટર્સ સ્પર્ધા છે. રેડ બુલ ઇ૧૬૧ ઇિંહીજના ભારતીય ફાઈનલમાં દેશમાં શ્રેષ્ઠ ડોટા-૨ ચેમ્પીયન જીવનમાં એક વખત પ્રાપ્ત થતી આ તક માટેના પ્રવાસમાં કરેલ ચાલુ વર્ષે દેશભરના રમતવીરોને તમામ ખર્ચાઓ પરત મેળવશે.

ભારતની અગ્રણી ઇસ્પોર્ટ્સ કંનપી નોડવિન ગેઇમીંગ, રેડ બુલ સાથે ફરી એક વખત ભાગીદારી કરશે અને ઇ૧૬૧ ઈિંહીજને દેશભરના વધુ મોટા

શકશે



જે વ્યક્તિ પાસે ફીઝીકલ અથવા ડિમેટાલાઇઝૂડ શેર કટ ઓફ ડેટ ૨૫મી સપ્ટેમ્બર.૨૦૧૯.બુઘવાર સુધીમાં હોય તે એજીએમની નોટીસમાં કાર્યવાહી તરીકે

# CMના કાર્યક્રમમાં સા.કાંઠાના <sup>થરાદ</sup> માર્કેટયાર્ડમાં ટીડીએસના વિરોધમાં વેપારીઓએ ત્રણ દિવસથી હરાજી બંધ કરી ચાર શિક્ષકોને સન્માનિત કરાશે થરાદ, એક કરોડથી વધારે ઉપાડ માર્કે ટયાર્ડમાં પર બે ટકા ટીડીએસ કપાતના એસોસિએશનની ઉપરોક્ત મદ્દે આવશે તેની વેપારીઓને જાણ પણ

હિંમતનગર. ૫ મી સપ્ટેમ્બર દિને '' મનની મોકળાશ '' અંતર્ગત સપ્ટેમ્બરે આવા સન્માનિત શિક્ષકોને શિક્ષક દિને મુખ્યમંત્રી દ્વારા ગાંધીનગર ગોષ્ઠિનું આયોજન કરાય છે. જેમાં જિલ્લા શિક્ષણાધિકારીના અધિકારી ખાતે મનની મોકળાશ કાર્યક્રમનું રાજયભરના સન્માનિત શિક્ષકોને આયોજન કરાયું છે જેમાં શિક્ષકોને આમંત્રિત કરાયા છે અને તેવા સન્માનિત કરાશે. ગાંધીનગર ખાતે શિક્ષકોની યાદી રાજયના શાળા કમિશ્રર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના દ્વારા જિલ્લાના શિક્ષણાધિકારીઓને નિવાસ સ્થાને તા.પ સપ્ટેમ્બરે શિક્ષક મોકલી આપવામાં આવી છે. તા.૪

Relicab રેલીકેબ કેબલ મેન્યુફેકચરીંગ લીમીટેડ રજીસ્ટર્ડ ઓફીસ : ૫૭/૧.(૪-બી)બેનસલોર ઇન્ડસ્ટીયલ એસ્ટેટ. દનેથા, દમણ-૩૯૬૨૧૦ (યુ.ટી.) CIN: L27201DD2009PLC004670 ૧૦મી સામાન્ય વાર્ષિક સભા અને બુક ક્લોજર અને કટોપ ડેટ ઈ-વોટીંગ ૧.આથી અહીં નોટીસ આપવામા આવે છે કે રેલીકેબ કેબલ મેન્યફેકચરીંગ લીમીટેડના સભ્યોની ૧૦મી સામાન્ય વાર્ષિક સભા (એજીએમ )તા ૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૯ સોમવારના રોજ બપોરે ૨.૦૦ વાગે ૫૭-૧,(૪-બી) બેનસલોર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, દુનેથા, દમણ-૩૯૬૨૧૦ (યૂ.ટી.) **બુક કલોઝરઃ** કંપની એકટ ૨૦૧૩ ની કલમ ૯૧ મુજબ તેના હેઠળ બનેલા નિયમ૧૦(મેનેજમેન્ટ અને એડમીનીસ્ટેશન) રૂલ્સ૨૦૧૪, મુજબ સભ્યો કંપનીની શેર ટ્રાન્સફર બુક મંગળવાર તા.૨૪મી કરાયુ છે. સપ્ટેમ્બર, ૨૦૧૯ થી તા.૩૦મી સપ્ટેમ્બર, ૨૦૧૯સોમવાર બન્ને દિવસ સહિતશેરહોલ્ડર ની યાદી માટે બંધ રહેશે. **૨.ઇ-વોટીંગઃ** કંપની એકટ ૨૦૧૩ની કલમ ૧૦૮ની જોગવાઇ મુબજ તેની સાથે નિયમ ૨૦ વાંચતા કેપનીઝ (મેનેજમેન્ટ અને એડમીનીસ્ટેશન) નિયમ ૨૦૧૪, નિયમ ૪૪ સેબી(લીસ્ટીંગઓબલીકેશન એન્ડ ડીસ્કલોઝર એન્ડ રીકવાયરમેન્ટ ) નિયમ ૨૦૧૫ એ એજીએમની નોટીસ આપવાની કાર્યવાહી તા.૭મી સપ્ટેમ્બર ૨૦૧૯ ના રોજ પુરી થઇ ગઇ છે. બી નોટીસમાં કાર્યવાહી બતાવાઇ છે તે ઇલેકટ્રોનીકસ મતદાનથી થશે. સી રીમોટ ઇ વોટીંગ તા.૨૭ મી સપ્ટેમ્બર ૨૦૧૯ શુક્રવારે સાવારે ૯ વાગે ચાલુ થશે ડી રીમોટ ઇ વોટીંગ તા.૨૯ મી સપ્ટેમ્બર ૨૦૧૯ રવિવારે સાંજે ૫ વાગે પુરુ થશે. ઇ કટ ઓફ ડેટ ૨૩ મી સપ્ટેમ્બર ૨૦૧૯ સોમવાર છે ત્યા સુધી નોઘાયેલા સભ્યો મતદાન કરી એફ. નોટીસ મોકલાઇ ગયા પછી જે વ્યિકત સભ્ય બન્યા હોય તેઓ રીમોટ ઇ વોટીંગ વેબસાઇટ www.relicab.net જી મદાઓ એરવિવારે ૨૯ સપ્ટેમ્બર, ૨૦૧૯ સાંજે ૫ પછી ઇ વોટીંગની મંજુરી આપવામાં આવશે નહી. બી બેલેટ પેપર મારફતે મત આપવાની સગવડ એજીએમના સ્થળે મળશે જેમણે રીમીટ ઇ વોટીંગથી મત નથી આપ્યા તેમને સી સભ્યોને સામાન્ય સભામાં હાજર રહેવાની તક મળશે પરંતુ જેમણે રીમોટ ઇ વટીગથી મત આપી દીધો હશે તેમને બીજી વાર મત આપવાની તક મળશે નહી. ડી જેમના નામ બેનીફીશયલ ઓવનરમાં ડીપોઝીટરી પાર્ટીસીપેન્ટની યાદીમાં જમના નામ તા.૨૩ સપ્ટેમ્બર ૨૦૧૯ સુધી હશે તેઓ જ માત્ર રીમોટ ઇ વોટીગનો અને મીટીંગમાં બેલેટ પેપરના મતદાન

એચ નોટીસ કંપનીની વેબસાઇટ-www.relicab.netપર ઉપલ્બઘ છે આઇ. ઇલેક્ટ્રોનીક બાબતે કોઇ પ્રશ્ન હોય તોwww.evoting.nsdl.com પ

આઈ.સારેક્ષ ડાયનામિક ઈન્ડીયા પ્રઈવેટ લિમિટેડ	બોર્ડ ઓફ ડાયરેકટર મારફતે રેલીકેબ કેબલ મેન્યુફેકટરીંગ લીમીટેડ વતી
ફોન નં ૦૨૨-૨૮૫૧૫૬૦૬/૨૮૫૧૫૬૪૪	સહી/-
<b>તારીખ :</b> ૦૮ સપ્ટેમ્બર, ૨૦૧૯ <b>સ્થળ :</b> મુંમ્બઈ	શ્રી ખુશ્બુ દેસાઈ કંપની સેક્રેટરી એન્ડ કમ્પલેસ ઓફ્સિર

**GUJCHEM DISTILLERS INDIA LIMITED** (CIN: L24230GJ1939PLC002480) REGD. OFFICE: Office No. 6, 2ndFloor, National Chambers, Nr. City Gold, Ashram Road, Ahmedabad - 380 009 E-mail id: gujchemdistillers@gmail.com Web: www.gujchemdistillers.com

લાયઝનીંગ કરીને ગાંધીનગર ખાતે કાર્યક્રમમાં ભાગ લેવા લઇ જવાની રાખવામાં આવતા ખેડુતો અને વ્યવસ્થા કરશે. જેમાં હિંમતનગરના વેપારીઓથી હર્યુંભર્યું રહેતું માર્કેટયાર્ડ છાપરીયા વિદ્યામંદિર ચલાવતા અને સુમસામ બનવા પામ્યું હતું. થરાદ સન્માનિત શિક્ષક જયંતિલાલ પટેલ, માર્કેટયાર્ડના એસોસિએશનના પ્રમુખે વડાલીના શિક્ષક પ્રકાશભાઇ સુથાર, બુધવારે પણ માર્કેટયાર્ડ ચાલુ થશે કે ખેડબ્રહ્માની સંતશ્રી રામજીબાપા કચ્છ કેમ તે નક્કી નહિ હોવાનું જણાવતાં કડવા પાટીદાર કન્યા વિદ્યાલયના ઉમેર્યું હતું કે માર્કેટયાર્ડના અભિપ્રાયો શિક્ષિકા સવિતાબેન.પી.પટેલ, લીધા બાદ નિર્ણય કરવામાં આવશે. વિજયનગર તાલુકાના કાલવણ કેન્દ્ર સરકાર દ્વારા નાણાકીય વર્ષ વસાહતના વિરેશ્વર વિદ્યાલયના શિક્ષક ૧/ ૪ /૨૦૧૯ થી વેપારીઓ દ્વારા નાગરસિંહ વેચાતસિંહ રાઠોડની પણ રોકડ ઉપાડ એક કરોડથી વધારે હોય પસંદગી થતા મુખ્યમંત્રીના નિવાસ તો તેના પર બે ટકા ટીડીએસ કપાત સ્થાને મનની મોકળાશ ગોષ્ઠિમાં ભાગ કરવાનું ઠરાવેલ છે. આથી લેવા જશે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી માર્કેટયાર્ડના કમિશન એજન્ટો વિજયભાઇ રૂપાણીના નિવાસ સ્થાને વેપારીઓ કે જે ખેડુતોના માલના તા.પ સપ્ટેમ્બરે શિક્ષક દિને '' મનની નાશાં રોકડમાં ચુકવે છે તેમને મોકળાશ '' અંતર્ગત ગોષ્ઠિનું આયોજન મુશ્કેલી ઉભી થાય તેમ છે. આથી थराह मार्કेटयार्ड द्वारा गत शनिवारे



૨. કંપની સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા ( ઇશ્યુ ઓફ કેપીટલ એન્ડ ડિસ્ક્લોઝર રિક્યાવરમેંટ) રેગ્યુલેશન, ૨૦૧૮ (ચેપ્ટર એક્સબી ઓફ ધસિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા ( ઇશ્યુ ઓફ કેપીટલ એન્ડ ડિસ્ક્લોઝર રિક્યાવરમેંટ) રેગ્યુલેશન, ૨૦૦૯)નાચેપ્ટર IX નિયમો હેઠળ લિસ્ટેડછે. જેના લીધે કંપનીએ. કંપની અધિનિયમ. ૨૦૧૩ની કલમ ૧૦૮ હેઠળ શેરહોલ્ડરોને ઇ-વોટિંગ સુવિધા પરીપાડવાની જરુર નથી. તેથી વાર્ષિક સામાન્ય સભામાં પહેલાં મતદાન કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ ૧૦૭ મુજબ ''હાથ બતાવીને ''હાથ ધરવામાં આવશેઅને જો ''એક શેર એક મત'' ની માંગણી કરવામાં આવશેતો કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ૧૦૯ મુજબ હાથ ધરવામાં આવશે

૩. કંપનીના નોંધાયેલા સભ્યો માટે કંપનીની શેર ટ્રાન્સફર બુક શનિવાર, ૨૧મી સપ્ટેમ્બર, ૨૦૧૯થી સોમવાર, તા.૩૦સપ્ટેમ્બર, ૨૦૧૯ સુધી (બન્ને દિવસ સહિત) કંપનીની વાર્ષિક સામાન્ય સભાના હેતુસર બંધ રહેશે તથા મંગળવાર, ૦૧ લી ઓક્ટોબર, ૨૦૧૯ના રોજ થી પુનઃ ખુલંશે તથા જે સભ્યોના નામ રજીસ્ટર પત્રકમાં નોંધાયેલા હશે અથવા બેનીફિશીયલ ના રજીસ્ટરમાં ડિપોઝટરીઝ દ્વારા કટ-ઓફ ડેટ શુક્રવાર, ૨૦મી સપ્ટેમ્બર, ૨૦૧૯ના રોજ નોધાયેલા હશે એ એજીએમમાં મત આપવાના અધિકારી હશે.

વિરોધમાં થરાદ માર્કેટયાર્ડના વેપારી બેઠક યો જાઈ હતી. જેમાં આ કરવામાં આવી હતી. આ અંગે એસોસિયેશન દ્વારા ત્રણ દિવસથી અંગેચર્ચા કરવામાં આવી હતી. થરાદ માર્કેટયાર્ડના વેપારી માર્કેટયાર્ડનું તમામ કામકાજ બંધ ચર્ચાના અંતે તારીખ ૧/૯/૨૦૧૯ એસોસિયેશનના પ્રમુખ અને યાર્ડના થી ૩ /૯/ ૨૦૧૯ ને મંગળવાર સુધી બોર્ડ ઓફ ડિરેક્ટર જેતસીભાઈ હરાજીનું તમામ કામકાજ બંધ પટેલે જણાવ્યું હતું કે મંગળવારે રાખવાનું ઠરાવવામાં આવ્યું હતું ઉપરોક્ત મુદ્દાની ચર્ચા બાદ તેમર્જ મંગળવારના રોજ માર્કેટયાર્ડ ચાંલુ કરવું કે કેમ તે માર્કેટયાર્ડના અભિપ્રાયો મુજબ અંગેનો નિર્ણય લેવામાં આવશે.

વેપારી આગળની કાર્યવાહી કરવામાં

3

**સિક્કો ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ** CIN:L51909GJ2000PLC037329 રજીસ્ટર્ડ ઓફિસ : ૫૦૮ ઇસ્કોન એલીગન્સ.જૈન મંદિર પાસે. પ્રહલાદનગર પીક અપ સ્ટેન્ડ પાસે, વેજલપુર, અમદાવાદ - ૩૮૦૦૫૧

# કંપનીની ૧૯મી વાર્ષિક સામાન્ય સભા અને બુક ક્લોઝર નોટીસ

આથી અહી નોટિસ આપવામાં આવે છે કે સિક્કો ઇન્ડસ્ટીઝ લીમીટેડ (ધ કંપની) ની ૧૯મી (ઓગણીસમી) વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) શનિવાર, તા.૩૦મી સપ્ટેમ્બર, ૨૦૧૯ના રોજ સાંજે ૦૪.૦૦ ક્લાકે રજીસ્ટર્ડ ઓફિસ ૫૦૮ ઇસ્કોન એલીગન્સ, જૈન મંદિર પાસે, પ્રહલાદનગર પીક અપ સ્ટેન્ડ પાસે, વેજલપુર, અમદાવાદ - ૩૮૦૦૫૧ ખાતે છે.જેમાં વર્ષિક સામાન્ય સભાની નોટીસમાં જણાવ્યા પ્રમાણે સામાન્ય અને ખાસ પ્રકારના કામો હાથ ઘરવામાં આવશે.

સભાસદો નો રજીસ્ટર અને કંપની શેર ટ્રાન્સફર બુક શનિવાર, ૨૧મી સપ્ટેમ્બર ૨૦૧૯થી ૩૦મી સપ્ટેમ્બર, ૨૦૧૯ના (બન્ને દિવસ સાથે) કંપનીની ૧૯મી વાર્ષિક સામાન્ય સભા ના લીધે બંધ રહેશે.

જે સભ્યોના ઈ-મેઇલ આઈડી કંપની અથવા ડિપોઝીટરી પાર્ટીસીપેન્ટ્રસ ખાતે નોંધાયેલા છે તેમને ઇલેક્ટ્રોનિક માધ્યમ થી અને જે સભ્યો ઇ-મેઇલ આઈડી કંપની અથવા ડિપોઝીટરી પાર્ટીસિપેન્ટ્સ ખાતે નોંધાયેલ નથી તેમને કંપનીની ૧૯મી (ઓગણીસમી ) વાર્ષિક સમાન્ય સભાની, કંપનીના નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ નો અહેવાલની ફીઝીકલ કોપી પહોંચાડી આપવામાં આવી

કાયદાની કલમ ૧૦૮ ની જોગવાઈ મુજબ,અને તેના અનુસંઘાનમાં બનેલા નિયમો તેમાં સમય સમય પર થતા સુઘારા પ્રમાશે કંપની સભાસદો ને ૧૯ મી વાર્ષિક સમાન્ય સભાની નોટીસમાં જણાવ્યા પ્રમાણેના ઠરાવો પર ઇલેકટ્રોનીકસ એટલે કે રિમોટ ઇ- વોટીંગની સુવિઘા પુરી પાડવામાં આવી નથી.કંપનીઝ એક્ટ ૨૦૧૩ હેઠળ વાર્ષિક સમાન્ય સભાના સ્થળે માન્ય પધ્ધતિએ મતદાન કરવાની સગવડ પુરી પાડવામાં આવશે.

૧૯મી વાર્ષિક સમાન્ય સભાની નોટીસ અને નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯નો વાર્ષિક અહેવાલ કંપનીની વેબસાઇટ www.sikkoindia.com પર ઉપલબ્ધ છે.

વાર્ષિક સમાન્ય સભા બાબતમાં કોઈ પણ પૂછપરછ હોય તો ઇમેઇલ compliance@sikkoindia.com ઉપર લેખિતમાં મોકલી શકો

છા.	સિક્કો ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ વતી
સ્થળ : અમદાવાદ	સહી-
તારીખ : ૦૭ સપ્ટેમ્બર, ૨૦૧૯	જયંતીભાઈ કુભાશી
	મેનેજીંગ ડિરેક્ટર

ઇલેક્ટ્રોનીકલી મતદાન કરી શકશે. જે માટે ઇલેક્ટ્રોનીક વોટીંગ સિસ્ટમ સેન્ટ્રલ ડિપોટઝરી સર્વિસ (ઇન્ડિયા) લીમીટેડ (સીડીએસએલ) મારફતે મતદાન કરી શકશે.

- બધા સભ્યોને જાણ કરવામાં આવે છે કે :
  - (એ) એજીએમની નોટીસમાં જણાવ્યા પ્રમાણેની કાર્યવાહી કદાચ ઇલેક્ટોનીક્સ મતદાનથી થાય.
  - (બી) ઇલેક્ટ્રોનીક માધ્યમથી વોટીંગ ૨૬મી સપ્ટેમ્બર, ૨૦૧૯ ગુરુવારના રોજ સવારે ૧૦.૦૦ વાગે ચાલ થશે અને ૨૯મી સપ્ટેમ્બર, ૨૦૧૯, રવિવારના રોજ સાંજે ૫.૦૦ વાગે બંધ થશે.
  - (સી) ૨૯મી સપ્ટેમ્બર, ૨૦૧૯ના રવિવાર રોજ સાંજે ૦૫.૦૦ વાગ્યા પછી ઈ-વોટીંગની મંજૂરી આપવામાં નહીં આવશે.
  - (ડી) જે સભ્યોના નામ રેકાર્ડેટ રજીસ્ટરમા દર્જ હશે બેનીફિસીલ ઓનર્સ તરીકે ડિપોઝટરીમાં દર્શાવેલ હશે અને ૨૫મી સપ્ટેમ્બર, ૨૦૧૯ બુઘવારની કટ ઓફ તારીખ સુધીમાં શેર ધરાવતા હોય, તો તે ઇવોટીંગની સવલતનો લાભ સામાન્ય સભામાં લઈ શકે છે.
  - (ઈ) એજીએમનોટીસ સીડીએસએલ વેબસાઇટ www.evotingindia.com ઉપર મેળવી શકે છે.
  - (એફ) ઇલેક્ટ્રોનીક વોટીંગ ની પ્રોસેસ અને મેનર માટે સભ્યો એજીએમની નોટીસમાં રહેલ નિર્દેશ અથવા સીડીએસએલની વેબસાઇટ www.evotingindia.com ઉપર જવું.
- ૪. 🖻 જો કોઈ વ્યક્તિ મીટીંગની નોટીસ મોકલ્યા બાર્દ કંપનીના સભ્ય બને અને બુઘવાર ૨૫મી સપ્ટેમ્બર, ૨૦૧૯ ની કટ ઓફ તારીખ સુધીમાં શેર ધરાવતા હોય, તો તે યુઝર આઈડી અને પાસવર્ડ દ્વારા સીડીએસએલની વેબસાઇટ www.evotingindia.com પર દર્શાવેલી નોટીસમાં જે સુચનાઓ છે તે પ્રમાશે ઈ-વોટીંગ કરી શકે છે.
- સભ્યો રીમોટ ઈ-વોટીંગ દ્વારા તેમનો મત આપ્યા બાદ પણ વાર્ષિક સામાન્ય સભામાં ભાગ લઈ શકશે, પરંતુ સભામાં ફરીવાર મત આપી શકશે નહીં.
- ઈ-વોટીંગ બાબતે કોઈ પણ બાબતનો પ્રશ્ન હોય તો તે અંગેનો ફ્રિકવન્ટલી આસ્કડ કવેશ્વન્સ (એફ.એ.ક્યુ) અને www.evotingindia.com ઉપર વોટીંગ યુઝર મેન્યુઅલનો હેલ્પ સેક્શનમાં અથવા અબદુલકાદીર શોયબ હાજીવાલા કંપની સેક્રેટરી ઉપર જણાવેલ સરનામા ઉપર કંપનીનો સંપર્ક અથવા compliance.mgc@gmail.com પર ઈ-મેઇલ કરી પૂછી શકે છે.કે પછી ઓફીસર અને કંપની સેક્રેટરી કમ્પલાયન્સ શ્રી અબ્દુલ કાદીર શોએબ હાઝીવાલા,નો ઉપરના સરનામાં અથવા ફોન નં.૯૧ ૭૯-૨૭૫૪૦૧૭૫ પર સંપર્ક કરી શકે છે.
- કંપની એકટ ૨૦૧૩ ની કલમ ૯૧ મુજબ તેની સાથે નિયમ ૧૦ વાંચતા કંપની 9. ( મેનેજમેન્ટ અને એડમીનીસ્ટ્રેશન ) નિયમ ૨૦૧૪ , રેગયુલેશન ૪૨ સેબીના (લીસ્ટીંગ ઓબ્લીગેશન અને ડીસ્કલોઝર રીકવાયરમેન્ટ ) નિયમ ૨૦૧૫ મુજબ સભ્યો માટે કંપનીની શેર ટ્રાન્સફર બુક તા.૨૬મી સપ્ટેમ્બર ૨૦૧૯ થી તા.૩૦ મી સપ્ટેમ્બર ૨૦૧૯ ( બન્ને દિવસ સહિત ) સામાન્ય વાર્ષિક સભાના તા.૩૦ મી સપ્ટેમ્બર ૨૦૧૯ સોમવારના રોજ ૩૧ માર્ચ ૨૦૧૯ ના નાશાંકીય વર્ષના અનુસંઘાને મળનાર છે તે હેતુ માટે બંધ રહેશે.

વતી એરોમાં એન્ટરપ્રાઇઝ ( ઇન્ડીયા ) લીમીટેડ

એસડી શ્રી સ્નેહલ પટેલ તારીખ : ૦૭-૦૯-૨૦૧૯ મેનેજીંગ ડાયરેકટર સ્થળ : અમદાવાદ ડીનનં. ૦૩૦૯૭૩૨૧

> Printed & Published by Mayur C. Bhatt on behalf of Kalyani Pub. Pvt. Ltd Printed at : Mahadev Offset, H-47, Ravi Estate Rustam Mill Compound Dudheswar, Ahmedabad-19. Published From: 37/ A, Rajlaxmi Tanament, Opp. Rami Vidhyalaya, Laxmipura, Gorva, Vadodara-

#### NOTICE OF 80th ANNUAL GENERAL MEETING E-VOTING INFORMATION

NOTICE is hereby given that the 80TH ANNUAL GENERAL MEETING of the Members of the Company will be held on Monday, 30th September, 2019 at 4.00 P.M. at the Registered Office of the Company situated at Office No.6, 2nd Floor, National Chambers, Nr. City Gold, Ashram Road, Ahmedabad-380009

The notice of the AGM along with the Annual Report, inter alia, including the remote e-voting instructions, Attendance Slip and Proxy Form has been sent by permitted mode to all members at their registered addresses. Notice of the AGM and this public notice for F Y 2018-19 can be downloaded from the website of the Company www.gujchemdistillers.com and of Central Depository Services (India) Limited (CDSL): www.cdslindia.com Remote e-voting:

Pursuant to the provisions of section 108 of the Companies Act, 2013, read with Rule 20 of the Companies (Management and Administration) Amendment Rules, 2015 ("the Rules"), and Regulation 44 of SEBI (Listing Obligations and Disclosure Requirements), Regulations, 2015 the Company is providing its members, the facility to exercise their right to vote by electronic means on all the business to be transacted as set forth in the Notice of the AGM of the Company through the remote e-voting facility provided by CDSL. The detailed instructions for remote e-voting facility are contained in Notice of the AGM which has been sent to the Members. The details pursuant to the provisions of the Companies Act, 2013 and the Rules are given hereunder:

Cut-off date for the purpose of remote e-voting: 23.09.2019 Date and time of commencement of remote e-voting: On 27th September, 2019 from 10:00 A.M.

Date and time of end of remote e-voting: On Sunday 29th September, 2019 at 5:00 P.M.

Remote e-voting shall not be allowed beyond the said time and date. Persons who have acquired shares and become members of the Company after dispatch of the Notice of the AGM and holding shares as on the cut-off date i.e 23th September, 2019 may cast their votes by following the instructions and process of remote e-voting as provided in the Notice of the AGM.

A person whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date only shall be entitled to avail the facility of remote evoting as well as voting in the AGM. However if the person is already registered with CDSL for remote e-voting than the existing user ID and password can be used for casting their vote.

The members who have already cast their vote by remote evoting prior to the meeting, May also attend the meeting, but shall not be entitled to cast their vote again.

The facility for voting through Poll Paper would be made available at the AGM and the members attending the meeting who have not already cast their votes by remote e-voting shall be able to exercise their right at the meeting through Poll Paper.

In case of any queries relating to e-voting, members/beneficial owners may refer the Frequently Asked Questions and e-voting user manual available at the CDSL website: www.evotingindia.com or contact at toll free number 1800-200-5533. In case of any grievances relating to e-voting please contact Mr. Wenceslaus Furtado, Deputy Manager, CDSL, 17th Floor, PJ Towers, Dalal Street, Fort, Mumbai- 400 001; Email: wenceslausf@cdslindia.com Tel. No. 022-22723333/8588

The entry at the meeting venue will be regulated by Attendance Slip, which has been sent along with the Annual Report to the members. Members are requested to submit duly filled in Attendance Slip at the registration counter to attend the AGM.

Date: 05/09/2019	By Order of the Board of Directors
Place: Ahmedabad	GUJCHEM DISTILLERS INDIA LIMITED
Regd. Office: Office No.6,	Sd/-
2nd Floor, National Chambers,	Nr. HEM MANISH
City Gold, Ashram Roa	ad, MANAGING DIRECTOR
Ahmedabad-380009	DIN-01428688

૪. વાર્ષિક સામાન્ય સભાની નોટીસની ઇલેકટ્રોનીક કોપી અને વાર્ષિક અહેવાલ જે સભ્યોના નામ ઇ-મેઇલ આઇડી કંપની-ડીપોઝીટરી પાર્ટીસીપેન્ટસમાં નોંધાયેલા છે તેમને મોકલી આપવામાં આવ્યા છે. જે સભ્યોના માન્ય સરનામાં નોંધાયેલા છે તેમને ફીઝીકલ કોપી તેમના સરનામાં પર પરમીટેડ મોડ પર મોકલી આપવામાં આવી છે.

૫. વાર્ષિક સામાન્ય સભાની નોટીસ અને વાર્ષિક અહેવાલ કંપનીની વેબસાઇટ www.zodiacenergy.com પર ઉપલબ્ધ છે.

૬. તેમ છતા વાર્ષિક સામાન્ય સભાને લગતા કોઇ પ્રશ્ન હોય તોકંપની સેક્રેટરી ના ઇ-મેઇલ cs@zodiacenergy.com ઉપર લેખિતમાં સંપર્ક કરી શકો છો. બોર્ડના આદેશ દ્વારા

ઝોડીયાક એનર્જી લીમીટેડ વતી

છો.

	એસડી-
સ્થળ : અમદાવાદ	નિયતી પરીખ
તારીખ : ૭ સપ્ટેમ્બર, ૨૦૧૯	કંપની સેક્રેટરી

કમ-ઓન કોમ્યુનિકેશન લીમીટેડ (CIN:L74110GJ1994PLC021216) રજીસ્ટર્ડ ઓફિસ: ૩૩૮ પૈકી દ-૨,ઘમાડચી ગામ,વલસાડ, ગુજરાત.૩૯૬૦૦૧ ફોનનં-૯૮૨૦૪૩૦૨૧૮ વેબસાઇટ-www.komeon.in ઇમેઇલ-info@komeon.in

#### નોટીસ

આથી અહી નોટિસ આપવામાં આવે છે કે,કમ-ઓન કોમ્યુનિકેશન લીમીટેડ ૨૬મી વાર્ષિક માન્ય સભા (એજીએમ) શનિવાર, તા.૩૦મી સપ્ટેમ્બર, ૨૦૧૯ના રોજ સવારે ૧૧.૦૦ ક્લાકે **૩૩૮ પૈકી૬-૨,ઘમાડચી ગામ,વલસાડ, ગુજરાત.૩૯૬૦૦૧** ખાતે એજીએમની નોટીસ, તેની સાથે રેકટરનો અહેવાલ,ઓડીટ રીપોર્ટ, અને ૩૧ માર્ચ ૨૦૧૯ ના નાંણાકીય વર્ષનો ઓડીટેડ ઇનાન્સીયલ સ્ટેટમેન્ટ માટે મળનાર છે.

એજીએમની નોટીસ અને ૨૦૧૮-૧૯નો વાર્ષિક અહેવાલ તેની સાથે રીમોટ ઇ વોટીંગની ાચનાઓ.હાજરીની સ્લીપ. પ્રોકસી ફોર્મ જેમના ઇમેઇલ આઇડી ડીપોઝીટરી પાર્ટીસીપેન્ટ-કંપની . ાથે નોંઘાયેલા છે તેમમને ઇમેઇલ કરવામાં આવ્યા છે.અને આ બઘુ તા.૭મી સપ્ટેમ્બર ૨૦૧૯ મુઘીમાં જેમના સરનામાં નોંઘાયેલા છે તેમને ફીઝકલ કોપી યોગ્ય પઘ્ધતિએ મોકલી આપવામાં આવી .વાર્ષિક અહેવાલ કંપનીની વેબસાઇટ www.komeon.in પર પણ ઉપલબ્ધ છે.

કંપનીઝ એકટ૨૦૧૩ ની કલમ ૧૦૮ કંપનીઝ (મેનેજમેન્ટ અને એડમીનીસ્ટેશન )નીયમ ૦૧૪ના નીયમ ૨૦મુજબ અને સુકયુરીટી એકસચેન્જ બોડ ( લીસ્ટીંગ ઓબ્લીગેશન અન્ડ ડીસકલોઝર ીકવાયરમેન્ટ ) નિયમ ૨૦૧૫ના નિયમ ૪૪(૧) ની જોગવાઈ મુજબ એજીએમના સ્થળ સિવાય ોટીસમાં જણાવ્યા પ્રમાણેના ઠરાવો માટે એનએસડીએલ મારફતે ( રીમોટ ઇ વોટીંગ )ની ઇલેકટ્રોનીક ાતદાન કરવાના સગવડ પરી પાડવામાં આવશે.

રીમોટ ઇ વોટીંગ ની માહિતી નીચે મુજબ છે.

૧ રીમોટ ઇ વોટીંગ શુકવાર ૨૭મી સપ્ટેમ્બર ૨૦૧૯ ( સવારે (.૦૦ વાગે )અને રવિવાર ..૨૯મી સપ્ટેમ્બર ૨૦૧૯ (સાંજે ૫ વાગે)પુરૂ થશે.ત્યારબાદ ઇ વોટીંગનું મોડયુલ દેખાશે નહી.

ર કંપનીની કટ ઓફ તારીખ. ૨૦મી સપ્ટમ્બર ૨૦૧૯ના રોજ જે પેઇડ અપ કેપીટલ શેર ઘરાવત કશે તેમને જ મતદાનનો હક્ક મળશે. એકવાર મતદાન થઇ ગયા પછી તેમાં ફરફાર કરવાની મંજૂરી મળશે નહી.

૩ કંપનીની નોટીસ વહેચાઇ ગયા પછી એટલે કે ટ ઓફ તારીખ.૨૦મી સપ્ટમ્બર ૨૦૧૯ યઘીમાં આને ૩૦ મી ઓગષ્ટ ૨૦૧૯ બાદ સબ્ય, બને તો લોગઇનની માહીતી કેપનીને ઇમેઇલ ુ info@komeon.in અથવા એનએસડીએલની evoting@nsdl.co.in અથવા service@satellitecorporate.com

૪ એજીએમના સ્થળે કંપની બેલેટ પેપર મારફતે પણ મતદાની સગવડ આપશે. સભ્યો મીટીગંમાં ઘજર રહી શકશે જેમણે રીમોટ ઇ વોટીંગ માર∌તે તમના મતદાનના હકકનો ઉપયોગ નથી કર્યો તેએ તોટીસમાં જણાવ્યા પ્રમાણેની કાર્યવાહી માટે એજીએમના સ્થળે બેલેટ પેપર મારફતે મત આપી શકશે. ' સભ્યએ રીમોટ ઇ વોટીંગથી મતદાન કરી લીધુ હશે તેઓ એજીએમમાં હાજર રહી શકશે પરંતુ ફરીથી મતદાન કરી શકશે નહી.

પ સભ્ય બન્નેમાંથી ગમે તે એક પધ્ધતિ જેમ કે રીમોટ ઇવોટીંગ અથવા તો બેલેટ જે સભ્ય બન્ને પકારના મત આપશે તો રીમોટ ઇ વોટીંગનો મત માન્ય ગણાશે અને બેલેટ પેપરનો મત અમાન્ય

ઇ વોટીંગ બાબતમાં કોઈ પણ પૂછપરછ હોય તો ફ્રીકવન્ટલી આસ્કડ ક્વેશ્વયન (એફએકયુએસ) ઇવોટીંગ મેન્યુયલી evoting@nsdl.com ઇમેઇલ evoting@nsdl.co.in ફોન ાં.૧૮૦૦૨૨૨૯૯૦ ટોલ ફ્રી નં. પર સંપર્ક કરવો

સ્થળ : વલસાડ	કમ-ઓન કોમ્યુનિકે
તારીખ : ૦૭, સપ્ટેમ્બર, ૨૦૧૯	ગજેન્દ્ર કાલુલ મેનેજીં

ડીનઃ ૦૦૫૮૭૮૦૭

#### LYPSA GEMS & JEWELLERY LIMITED Regd. Off.: Wing A, 2nd Block, 202-302, Orchid Complex, Opp. HDFC Bank, Chhapi-Pirojpura Road, Chhapi, Vadgam Banas Kantha, 385210, Gujarat, Contact No: 022-23679792. Email ID: info@lypsa.in CIN: L28990GJ1995PLC028270, Website: www.lypsa.in

#### NOTICE

NOTICE is hereby given that the 24th Annual General Meeting of the Members of Lypsa Gems & Jewellery Ltd will be held at Wing A, 2nd Block, 202-302, Orchid Complex, Opp. HDFC Bank, Chhapi-Pirojpura Road, Chhapi, Vadgam Banas Kantha GJ 385210 Gujarat on Monday, 30<sup>th</sup> September, 2019 at 02.00 p.m. to transact the business as set out in the Notice of AGM dated September 5, 2019

The said Notice along with Proxy form, Attendance Slip and Annual Report inter-alia containing Directors' Report and Audited Financial Statements has been dispatched to all the Members at their registered addresses or email-Dis on or before September 5, 2019 and the same is available on the website of the company at <u>www.lypsa.in</u> The Notice of AGM along with e-Voting instructions is also available on the website of Central Depositon Services Limited (CDSL) at www.evotingindia.com

A member entitled to attend and vote at the meeting is entitled to appoint a proxy to attend and vote instead of himself/herself and the proxy need not be a membe of the Company. Proxies in order to be effective, should be deposited at the Registere Office of the Company, duly completed and signed, not less than 48 hours before the commencement of the AGM

n compliance with the provisions of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended from Time to time, Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements Regulations, 2015 and Secretarial standard on General Meetings issued by The Institute of Company Secretaries of India:

a) The Company is providing remote e-Voting facility to its Members to cast their vote by electronic means on the Resolutions set out in the Notice of the AGM dated September 5.2019

b) Day, Date and Time of commencement of remote e-Voting: Friday, September 27, 2019 (09.00 a.m.)

c) Day, Date and Time of end of remote e-Voting; Sunday, September 29, 2019 (05.00 p.m.)

d) Cut-off date: September 23, 2019

e) Any person who acquires shares of the Company and becomes a member of the Company after the dispatch of AGM Notice and holds shares as on the cut-off date i.e. Septembe 23, 2019, may obtain Login ID and password by sending request at www.evotingindia.com

The members who will be attending the AGM and who have not cast their vote through remote e-Voting shall be able to exercise their voting rights at the AGM. The facility for voting through Tablet based e-Voting system and / or through polling paper shall be made available at the venue of the AGM.

g) The Members are requested to note that:

- Remote e-Voting modules shall be disabled by CDSL for voting after 05.00 p.m. on September 29, 2019.
- The members who have already cast their vote through remote e-Voting may attend the meeting but shall not be entitled to cast their vote again at the AGM.

Members holding shares in physical or in dematerialized form as on September 5, 2019 shall only be entitled to avail the facility of remote e-Voting or voting through Tablet based e-Voting system and/or through polling paper at the

in case you have any queries or issues regarding e-voting, you may refer the Frequently Asked Questions ("FAQs") and e-voting manual available at www.evotingindia.com, unde help section or write an email to helpdesk.evoting @cdslindia.com.

Mrs. Shubham Agarwal, Practicing Company Secretary (CP No. 10640 and FCS 8192) as been appointed as the Scrutinizer for overseeing / conducting the remote e-Voting and the voting process in a fair and transparent manner.

Pursuant to Section 91 of the Companies Act, 2013, the Begister of Members and Shan nsfer Books of the Company will remain closed from Wednesday, September 25, 2019 to Monday, September 30, 2019 (both days inclusive) for the purpose of Annual General Meeting to be held on September 30, 2019.

The result of the e-Voting / voting at AGM through Tablet based e-Voting system and / or through polling paper shall be declared on or before October 3, 2019 The results declared along with the Scrutinizer's Report shall be placed on the Company's website and nmunicated to stock exchanges where the Company's shares are listed

કમ-ઓન કોમ્યુનિકેશન લીમીટેડ <b>સહી</b> -		For & on behalf of the Board of Director Lypsa Gems And Jewellery Limited Sd/- Company Secretary
ગજેન્દ્ર કાલુલાલ સાલ્વી મેનેજીંગ ડિરેક્ટર	Date:5" September, 2019	Akanksha Mundra
119115552	Place: Banaskantha	DIN: 02579405